



Imame Hasan Ki 30 Hikayaat (Gujarati)

رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ

# ઇમામે હસન કી 30 હિકાયાત

માટે ઇમામે  
હસન મુજલતબા

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઇસ્લામી, હારતે અલ્લામા મૌલાના અલૂ જિલાલ  
**મુહુમુહ હલ્યાસ અત્તાર કાદિરી ર-હવી** كَادِيرِيَ رَهْوِي

**الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ**  
**أَمَّا بَعْدُ فَاعُوذُ بِإِلٰهِي مِنَ الشَّيْطٰنِ الرَّجِيمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيمِ**

## ਕਿਤਾਬ ਪਟਨੇ ਕੀ ਦੁਆ

અજ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્ત, બાનિયે દા'વતે ઈસ્લામી, હજરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાફિરી ૨-જવી **ડામ્થ પ્રકાશ્ઠી ઉન્નાયિ**

ਫਿਨੀ ਕਿਤਾਬ ਯਾ ਇਸਲਾਮੀ ਸਭਕ ਪਥਨੇ ਸੇ ਪਹਲੇ ਜੈਲ ਮੌਦੂ ਵਿੱਚ ਹੁਆ ਪਥ ਲੀਜਿਏ  
ਜੋ ਕੁਝ ਪਛੋਗੇ ਧਾਰ ਰਹੇਗਾ। ਹੁਆ ਧੇਹ ਹੈ :

اللهم افتح علينا حكمتك وانشر  
علينا رحمتك يا ذا الجلال والأكرام

**તરજમા :** એ અલ્લાહ રબ! હમ પર ઇથ્યો ડિકમત કે દરવાજે ખોલ દે ઔર હમ પર અપની રહમત નાભિલ ફરમા! એ અ-જમત ઔર બુગુરી વાચે! (المُسْتَرِّفُ ح ٤٠، دار الفكير بيروت)

**નોટ :** અવ્યાલ આખિર એક એક બાર દુર્દૃઢ શરીર પદ લીજિયે.

ਈਮਾਮੇ ਹਸਨ ਕੀ 30 ਲਿਕਾਇਆਤ

યેહ રિસાલા (ઇમામે હસન ક્રી 30 હિકાયાત)

शैघे तरीकत, अभीरे अहले सुन्नत, बानिये दा'वते ईस्लामी हजरत  
अल्लामा मौलाना अबू बिलाल मुहम्मद ईत्यास अत्तार काउंट्री २-जवी जियाई  
ने उद्द अबान में तहरीर फरमाया है.

મજલિસે તરાકિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઔર મક-ત-બતુલ મદીના સે શાઅએ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગહ કભી બેશી પાણો તો મજલિસે તરાકિમ કો (બ જરીઅએ મક્તુબ, ઈ-મેઈલ યા [SMS](#)) મુત્તલાં ફરમા કર સવાબ કમાઈયે.

## રાબ્ધિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

ਮਕ-ਤ-ਬਤੁਲ ਮਈਨਾ, ਸਿਲੇਕਟੇਡ ਹਾਊਸ, ਅਲਿੱਫ ਕੀ ਮਾਰਿਓ ਦੇ ਸਾਮਨੇ,

તीન દરવાજા, અહમદાબાદ-૧, ગુજરાત

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ يٰسِّرِ اللّٰهِ الرَّحْمَنِ الرَّحِيمِ

# ઈમામે હસનું કી 30, હિકાયાત

શૈતાન લાખ સુસ્તી દિલાએ યેહ રિસાલા પૂરા પઠ લીજિયે,  
મા'લૂમાત કે સાથ સાથ હજરતે ઈમામે હસન  
કી મહિષત દિલ મેં મૌજે મારને લગેણી.

## દુરુદે પાક લિખને કી બ-ર-કત

હજરતે સાધ્યદુના અભુલ અભ્યાસ ઉક્લિશી કો બા'દે  
વફાત કિસી ને ખ્વાબ મેં જન્નત મેં દેખા. પૂછા : આપ ને  
યેહ મકામ કેસે પાયા? જવાબ દિયા : અપની કિતાબ “અલ અર-બઈન”  
મેં કસરત સે દુરુદ શરીર લિખને કી વજહ સે. (القول البديع من ٤٦٧ نماذج)

صَلُوٰ عَلَى الْحَكِيْبِ! صَلُوٰ اللّٰهُ تَعَالٰى عَلَى مُحَمَّدٍ

﴿1﴾ ખુશક દરખ્ત પર તમા ખજૂરેં

આરિઝ બિલ્લાહ, હજરતે સાધ્યદુના નૂરુદીન અબ્દુરહ્માન જામી  
ફُرમાતે હોય : ઈમામે આલી મકામ હજરતે સાધ્યદુના ઈમામે  
હસન મુજતબા સફર કે દૌરાન ખજૂરોં કે બાગ સે ગુરુરે જિસ  
કે તમામ દરખ્ત ખુશક હો ચુકે થે, હજરતે સાધ્યદુના અબ્દુલ્લાહ ઈન્ને

ફરમાને મુસ્તકી : ﷺ : જિસ ને મુજ પર એક બાર હુરૂદે પાક પઢા અલ્લાહ ઉર્જોબુલ (ઉસ પર દસ રહમતે ભેજા હૈ) (بسم)

ગુબૈર ભી ઈસ સફર મેં સાથ થે. હજરતે ઈમામે હસન ગુબૈર ને ઉસ બાગ મેં પડાવ ડાલા (યા'ની ડિયામ કિયા). ખુદામ ને એક સૂખે દરખ્ત કે નીચે આરામ કે લિયે બિછોના બિધા ટિયા. હજરતે સાયિદુના અખુલ્લાહ ઈબ્ને ગુબૈર ને અર્જ કી : ઐ નવાસએ રસૂલ ! કાશ ! ઈસ સૂખે દરખ્ત પર તાજા ખજૂરેં હોતીં ! કે હમ સૈર હો કર ખાતે. યેહ સુન કર હજરતે સાયિદુના ઈમામે હસન મુજતબા ﷺ ને આહિસ્તા આવાજ મેં કોઈ દુઆ પઢી, જિસ કી બ-ર-કત સે ચન્દ લમ્હોં મેં વોહ સૂખા દરખ્ત સર સબજો શાદાબ હો ગયા ઔર ઉસ મેં તાજા પક્કી ખજૂરેં આ ગઈ. યેહ મન્જર દેખ કર એક શુતુરબાન (યા'ની ઊંટ હાંકને વાલા) કહને લગા : યેહ સબ જાદૂ કા કરિશમા હૈ. હજરતે સાયિદુના અખુલ્લાહ ઈબ્ને ગુબૈર ﷺ ને ઉસે ડાંટા ઔર ફરમાયા : તૌબા કર, યેહ જાદૂ નહીં બલ્કે શહઝાદે રસૂલ કી દુઆએ મકબૂલ હૈ. ફિર લોગોં ને દરખ્ત સે ખજૂરેં તોડીં ઔર કાફિલે વાલોં ને ખૂબ ખાઈ.

(شواعد النبوة مص ٢٢٧)

રાકિબે દોશે શહન્શાહે ઉમમ યા હસન ઈબ્ને અલી ! કર દો કરમ !  
ફાતિમા કે લાલ હેદર કે પિસર ! અપની ઉલ્ફત દો મુજે દો અપના ગમ

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى عَلِيٍّ مُحَمَّدَ**

## ﴿2﴾ વિલાદત સે કળ બિશારત

રસૂલે અકરમ, નૂરે મુજસ્સમ ﷺ કી ચચીજાન  
હજરતે સાયિ-દતુના ઉભુલ ફઝૂલ ને આપ સે અપના ખવાબ

ફરમાને મુસન્દા : **عَلَيْهِ السَّلَامُ عَلَيْكَ اللَّهُمَّ أَسْتَأْمُنُكَ** : ઉસ શાખસ કી નાક ખાક આલૂદ હો જિસ કે પાસ મેરા જિક હો ઔર વોહ મુજ પર હૃદાએ પાક ન પઢે. (તરણી)

અર્જ કિયા : “યા રસૂલલ્હા ષ ! ﷺ ! આપ કે મુખારક જિસમ કા હિસ્સા મેરે ઘર આયા હૈ.” યેહ સુનતે હી આપ ﷺ ને ઈશ્વરાદ ફરમાયા : “તુમ ને અચ્છા ખ્વાબ દેખા, ફાતિમા કે યહાં બેટા પૈદા હોગા ઔર તુમ ઉસે દૂધ પિલાઓગો.” જબ હજરતે સાયિ-દતુના ફાતિ-મતુજુઝહરા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કે હાં હજરતે સાયિદુના ઈમામે હસન મુજતબા કી **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** વિલાદત હુદ્દી તો હજરતે સાયિ-દતુના ઉમ્મુલ ફ઼઼લ ને આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કો દૂધ પિલાયા.

(الذرية الطاهرة للدولابي ص ٧٢)

## વિલાદતે બા સાયાદત વ નામ વ અલ્કાબ

ઈમામે આલી મકામ, ઈમામે હુમામ, ઈમામે અર્શ મકામ હજરતે સાયિદુના ઈમામ અબૂ મુહમ્મદ હસન મુજતબા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કી વિલાદતે બા સાયાદત 15 ર-મજાનુલ મુખારક 3 હિજરી મે હુદ્દી. (૩૦૨ ص ૬) આપ કા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** નામ : હસન, કુન્યત : અબૂ મુહમ્મદ ઔર અલ્કાબ : તકી, સાયિદ, સિબ્જે રસૂલુલ્હા ઔર સિબ્જે અકબર હૈ, આપ કો રૈહા-નતુરરસૂલ (યા'ની રસૂલે ખુદા કે ફૂલ) ભી કહતે હોય.

ક્યા બાત રાજા ઉસ ચ-મનિસ્તાને કરમ કી  
જહરા હે કલી જિસ મેં હુસૈન ઔર હસન ફૂલ

(હદાઈકે અભિષાશ, સ. 79)

**صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى الْخَيْبِ!**

કરમાને મુસ્તકફા : ﷺ : صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુજ પર દસ મરતબા દુરૂહે પાક પણે અલ્લાહ ગ્રેગ્લ તુસ પર સો રહ્મતે નાભીલ કરમાતો હૈ. (طبراني)

## હમ-શકલે મુસ્તકા

હજરતે સચ્ચિદુના અનસ બિન માલિક رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ સે રિવાયત હૈ કે (ઈમામે) હસન (رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ) સે બઢ કર રસૂલે કરીમ એ સે મિલતા જુલતા કોઈ ભી શખ્સ ન થા.

(بخاري ج ٢ ص ٥٤٧ حديث ٣٧٥٢)

## ઔસા બેટા કિસી માં ને નહીં જના !

હજરતે સચ્ચિદુના અબ્દુલ્લાહ ઈન્ને જુબૈર ભી દીગર સહાબાએ કિરામ કી તરફ નવાસએ રસૂલ હજરતે સચ્ચિદુના ઈમામે હસન رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ સે બહુત મહિબત ફરમાતે થે. એક મૌકાએ પર આપ ને ફરમાયા : “અલ્લાહ ગ્રેગ્લ કી કસમ ! ઔરતોને હસન બિન અલી (رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ) જૈસા ફરજના નહીં જના.”

(سبل الهدى ج ١ ص ٦٩)

## શક્કતે મુસ્તકા ! મરહબા !

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! નાબિય્યે રહ્મત, શાફીએ ઉમ્મત સે رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કો સચ્ચિદુના ઈમામે હસન મુજતબા એ બહુત મહિબત થી. આપ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ હજરતે સચ્ચિદુના ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કો કભી આગોશે શક્કત (યા'ની મુખારક ગોદ) મેં ઉઠાએ તો કભી દોશે અકદસ (યા'ની મુખારક કન્ધોં) પર સુવાર કિયે હુએ ઘર શરીરફિસે બાહર તશરીફ લાતે, કભી આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કો દેખને ઓર

ફરમાને મુસના : ﷺ : જિસ કે પાસ મેરા જિક હુવા ઔર ઉસ ને મુજ પર હુર્દે પાક ન પડા તહકીક વોહ બદ બખ્ત હો ગયા. (બિન સત્ય)

ઘાર કરને કે લિયે સચ્ચિદાનંદ ફાતિમા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهَا કે ઘર શરીફ પર તશરીફ લે જાતે, હજરતે સચ્ચિદુના ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ભી આપની સે صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ બેહદ માનૂસ હો. (યા'ની હિલ) ગએ થે કે કબી નમાઝ કી હાલત મેં મુખારક પીઠ પર સુવાર હો જાતે.

### ﴿3﴾ રાકિબે દોશે મુસ્તફા

એક મર્તબા હુજૂરે પુરનૂર صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ હજરતે સચ્ચિદુના ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કો શાનએ અકદસ (યા'ની મુખારક કન્દ્ય) પર સુવાર કિયે હુએ થે તો એક સાહિબ ને અર્જ કી : يَعْمَلُ الْمَرْكَبَ رَكْبَتَ يَا غَلَمَانَ યા'ની સાહિબ જાણ ! આપ કી સુવારી તો બડી અચ્છી હૈ. રસૂલ અકરમ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ફરમાયા : وَنَفَمُ الرَّاكِبُ هُوَ (તર્મદી જ ૪૩૨ ચ ૫૦ હિથ ૧૧૮)

વોહ હસન મુજતબા, સચ્ચિદુલ અસ્થિયા

રાકિબે દોશે ઈજૂઝત પે લાખોં સલામ

(હદાઈકે બાજિશાશ, સ. 309)

**صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ صَلَّى اللَّهُ تَعَالَى عَلَى الْحَبِيبِ!**

### ﴿4﴾ અબૂ હુરૈરા દેખતે તો રો પડતે

હજરતે સચ્ચિદુના અબૂ હુરૈરા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ફરમાતે હૈ : મૈં જબ (ઈમામે) હસન કો દેખતા તો મેરી આંખોં સે આંસૂ જારી હો

ફરમાને મુસ્તફા ﷺ : [جس نے مુજ પર સુખ વ શામ દસ દસ બાર હુરુદે પાક પડા ઉસે કિયામત કે દિન મેરી શરૂઆત મિલેણી] (مجمع الزوائد)

જાતે ઔર નબિયે કરીમ ﷺ એક દિન બાહર તશરીફ લાએ મુજે મસ્તિષ્ઠ મેં દેખા, મેરા હાથ પકડા, મેં સાથ ચલ પડા, આપ તો આપ ﷺ ને મુજ સે કોઈ બાત ન કી યહાં તક કે હમ બન્ને કૈનુકાએ કે બાગાર મેં દાખિલ હુએ ઔર ફિર હમ વહાં સે વાપસ આએ તો આપ ﷺ ને ફરમાયા : “છોટા બચ્ચા કહાં હૈ, ઉસે મેરે પાસ લાઓ !” હજરતે સાચિદુના અબૂ હુરૈરા رضي الله تعالى عنه ફરમાતે હૈને : મૈં ને દેખા, (ઈમામે) હસન આએ ઘારે મુસ્તફા رضي الله تعالى عنه ને અપની જબાન મુબારક ઉન કે મુંહ મેં ડાલ દી ઔર તીન મર્તિબા દર્શાવ ફરમાયા : “એ અલ્લાહ ! મૈં ઈસે મહબૂબ (યા'ની ઘારા) રખતા હુંતૂ ભી ઈસે મહબૂબ (યા'ની ઘારા) રખ ઔર જો ઈસ સે મહિબત કરતા હો ઉસે ભી મહબૂબ (ઘારા) રખ.” (الاب المفرد، ص ٣٠، حديث ١١٨٣)

ફાતિમા કે લાલ હેંદર કે પિસર !

અપની ઉદ્ધત દો મુજે દો અપના ગમ

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى الْحَبِيبِ !**

**﴿5﴾ એ મેરે સરદાર !**

તાબેઈ બુગુર્જ હજરતે સાચિદુના અબૂ સર્દિં મકબુરી عليه رحمة الله القوي ફરમાતે હૈને : હમ હજરતે સાચિદુના અબૂ હુરૈરા رضي الله تعالى عنه કે સાથ થે, હજરતે સાચિદુના ઈમામે હસન ભી વહાં તશરીફ લાએ ઔર

ફરમાને મુસનફી : **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** : જિસ કે પાસ મેરા જિક હુવા ઓર ઉસ ને મુજ પર ફુર્રદ શરીર ન પઢા ઉસ ને જફા કી. (بِسْمِ الرَّحْمَنِ)

હમેં સલામ કિયા, હમ ને સલામ કા જવાબ દિયા લેકિન હજરતે સચ્ચિદુના અભૂ હુરૈરા કો **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** (સલામ કરને કા) પતા ન ચલા. હમ ને અર્જ કી : એ અભૂ હુરૈરા ! (હજરતે ઈમામે) હસન બિન અલી **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ને હમેં સલામ કિયા હૈ તો આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ફૌરન (હજરતે ઈમામે) હસન **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કી જાનિબ મુ-તવજ્જેહ હુએ ઔર ફરમાયા : **وَعَلَيْكَ السَّلَامُ يَا سَيِّدِي!** હો. મૈં ને નબિયે કરીમ કો ફરમાતે સુના હૈ કે બેશક હસન “સચ્ચિદ” (યા’ની સરદાર) હૈ. (المستدرك ج ٤ ص ١٦١ حديث ٤٨٤٥)

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

### ﴿6﴾ યેહ મેરા ફૂલ હૈ

હજરતે સચ્ચિદુના અભૂ બકરહ ફરમાતે હૈં કે નબિયે કરીમ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ફરમાતે હૈં કે નબિયે નમાઝ પઢા રહે થે કે (હજરતે ઈમામે) હસન બિન અલી **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** જો અભી છોટે સે થે તશરીફ લાએ. જબ ભી રસૂલે અકરમ **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** સજદા ફરમાતે (હજરતે ઈમામે) હસન મુજતબા કી ગરદન શરીર ઓર પીઠ મુખારક પર બૈઠ જાતે. આપ **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** સરકારે મદ્દીના નિહાયત આરામ સે અપના સરે અકદસ સજદે સે ઉઠાતે ઔર ઉન્હેં શફ્કત સે ઉતારતે. જબ નમાઝ મુક્કમલ કર લી તો સહાબાએ કિરામ **عَلَيْهِمُ الرِّضْوَانُ** ને અર્જ કી : યા

ફરમાને મુસના : ﷺ : જો મુજ પર રોજે જુમુઆ ફુર્દ શરીર પઢેગા મેં ડિયામત કે દિન ઉસ કી શક્તિઅત કર્દુંગા। (جمع الحجاج)

રસૂલલલાહ ! ﷺ ! ઈસ બરચે સે આપ ઈસ અન્દાજ સે પેશ આતે હું કે કિસી ઓર સે ઐસા સુલૂક નહીં ફરમાતે ? ઈશ્વાર ફરમાયા : “થેહ દુન્યા મેં મેરા ફૂલ હું”

(مسند بزارج ١١١ حديث ٣٦٥٧ ملخصاً)

ઉન દો કા સદકા જિન કો કહા મેરે ફૂલ હું

કીજે રાન કો હશર મેં ખનાં મિસાલે ગુલ

(હદાઈકે બાણીશ, સ. 77)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى عَلِيٍّ مُحَمَّدٍ

### ﴿7﴾ મેરા યેહ બેટા સરદાર હૈ

હજરતે સાચ્છદાના અભૂ બકરદું ફરમાતે હું કે મૈં ને દેખા કે સરકારે નામદાર, મદીને કે તાજદાર صلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મિમબર પર જલ્વાગર થે ઓર (ઈમામ) હસન બિન અલી (رضي الله تعالى عنهما) આપ (ઈમામ) હસન બિન અલી કે પહ્લુ (યા'ની બરાબર) મેં થે. નબિએ કરીમ કલ્ની લોગોં કી તરફ તવજજોહ કરતે ઓર કબી (ઈમામ) હસન કી તરફ નજર ફરમાતે, આપ સરદાર (غَوْلَ) હિસ કી બદૌલત મુસલ્માનોં કી દો બડી જમાઅતોં મેં સુલ્હ ફરમાયેગા।”

(بخارી ج ٢١٤ ص ٢١٤ حديث ٢٧٠٤)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى عَلِيٍّ مُحَمَّدٍ

ફરમાને મુસનફ : ﷺ : જિસ કે પાસ મેરા જિક હુવા ઔર ઉસ ને મુજ પર દુર્દે પાક ન પઢા ઉસ ને જન્મત કા રાસ્તા છોડ દિયા. (طبراني)

## ﴿8﴾ ઇમામે હસન મુજતબા કી ખિલાફત

અમીરુલ મુઅમિનીન હજરતે સાચિદુના અલિયુલ મુરત્જા શેરે ખુદા ખુદાની રૂપી શહાદત કે બા'દ હજરતે સાચિદુના ઈમામ હસન મુજતબા મસ્નાદે ખિલાફત પર જલ્વા અફરોઝ હુએ તો અહલે કૂફા ને આપું રૂપી શહાદત કે દસ્તે મુખારક પર બૈઅત કી. આપ ને વહાં કુદ્દ અસરી કિયામ ફરમાયા ફિર ચન્દ શરાઈત કે સાથ ઉમ્ભૂરે ખિલાફત હજરતે સાચિદુના અમીરે મુઆવિયા રૂપી શહાદત ને તમામ શરાઈત કબૂલ કીં ઔર બાહ્ય સુલહ હો ગઈ. યું તાજદારે રિસાલત, શહન્શાહે નુભુવ્યત બદૌલત મુસલ્માનોં કી દો જમાઅતોં મેં સુલહ ફરમાયેગા.

(સવાનેદે કરબલા, સ. 96 મુલખ્યસન)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى مُحَمَّدٍ

## ﴿9﴾ ઇમામે હસન મુજતબા કા ખુત્બા

હજરતે સાચિદુના શૈખ યુસુફ બિન ઈસ્માઈલ નબહાની ફેલિસ સ્રો ન્યૂર્ઝાની ફરમાતે હેં : જબ હજરતે સાચિદુના ઈમામે હસન મુજતબા રૂપી શહાદત ને હજરતે સાચિદુના અમીરે મુઆવિયા રૂપી શહાદત કી બૈઅત કર લી ઔર ઉમ્ભૂરે ખિલાફત ઉન કે સિપુર્દ ફરમા દિયે તો હજરતે સાચિદુના અમીરે

ફરમાને મુસ્તફા : ﷺ : مُعَذِّبٌ بَرَّ حُرُودَهُ وَمُؤْمِنٌ  
પદના તુમહારે લિયે પાકીજગી કા બાર્દસ હૈ. (اب્યુખી)

મુખ્યાવિયા રَغْفَى اللَّهُ تَعَالَى عَنْهُ كુઝું આને સે પહોલે આપને ને લોગોંને  
સે જિતાબ કરતે હુએ ઈર્શાદ ફરમાયા : “એ લોગો ! બેશક હમ તુમહારે  
મેહમાન હોએ ઓર તુમહારે નાણી ﷺ કે અહોલે બૈત હોએ કે  
જિન સે અલ્લાહ ગુર્ગલ ને હર કિસ્મ કી નાપાકી દૂર કર દી ઓર ઉન્હેં ખૂબ  
સુથરા ફરમા દિયા.” યેહ કલિમાત (યા'ની જુમ્લે) આપને  
બાર બાર દોહરાએ હતા કે મજલિસ મેં મૌજૂદ હર શખ્સ રોને લગા ઓર  
ઉન કે રોને કી આવાજ દૂર તક સુની ગઈ. (બરકાતે આલે રસૂલ, સ. 138)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

### ﴿10﴾ દુન્યા કી શર્મ અગ્રાબે આભિરત સે બેહતર હૈ

હજરતે સાધ્યિદુના ઈમામે હસન મુજતબા ૪૭  
ખિલાફત સે દસ્ત બરદાર હો ગએ તો બા'જ ના વાકિફ લોગ આપ કો યા  
આરલ મુઅમ્નીન (યા'ની એ મુસલ્માનોં કે લિયે બાઈસે શર્મી) કહ કર પુકારતે,  
ઈસ પર આપ રَغْفَى اللَّهُ تَعَالَى عَنْهُ ફરમાતે : “આર, નાર સે (યા'ની દુન્યા કી યેહ  
શર્મ અગ્રાબે આભિરત સે) બેહતર હૈ.” (الاستيعاب ج 1 ص ૧૩૮)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

### સબ સે પહોલે ગૌસે આ'જમ

ઈમામે હસન મુજતબા કી આજિઝી મરહબા ! તર્ક  
ખિલાફત કે સિલે મેં, અલ્લાહ તાયાલા ને આપ રَغْفَى اللَّهُ تَعَالَى عَنْهُ કો ગૌસે  
આ'જમ કા રૂતબા અતા ફરમાયા. જૈસા કે ફતાવા ૨-જવિયા જિલ્દ 28

કરમાને મુસનફા ﷺ : جس کے پاس મेरા જિક હો ઔર વોહ મુજ પર દુર્દશ શરીર ન પડે તો વોહ લોગોં મેં સે કંજૂસ તરીન શર્પસ હૈ. (مسند احمد)

સફુહા 392 પર અલ્લામા અલી કારી હ-નફી મક્કી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِيِّ કે હવાલે સે નકલ હૈનું : “બેશક મુજે અકાબિર (યા'ની બુઝગોં) સે પહોંચા કે સચ્ચિદુના ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને જબ બ ખયાલે ફિતના વ બલા (યા'ની મુસલ્માનોં મેં ફસાદ ખત્મ કરને કે ખયાલ સે) યેહ બિલાફત તર્ક ફરમાઈ, અલ્લાહ ગુરૂજલ غُرَوْجَلٌ ને ઈસ કે બદલે ઈન મેં ઔર ઈન કી ઔલાદે અભ્યાદ મેં ગૌસિથ્યતે ઉઠ્ઠમા કા મર્તબા રખા. પહલે કુત્બે અકબર (ગૌસે આ'જમ) ખુદ હુન્દૂર સચ્ચિદુના ઈમામે હસન હુએ ઔર ઔસત (યા'ની બીચ) મેં સિર્જ હુન્દૂર સચ્ચિદુના અભુલ કાદિર ઔર આબિર મેં હજરતે ઈમામ મહદી હોંગે. رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمْ أَجْمَعِينَ. (ફતાવા ર-અવિયા, જિ. 28, સ. 392)

**صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلُّوا عَلَى الْحَبِيبِ!**

### બિલાફતે રાશિદા

નબિયે કરીમ عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِيِّ કે બા'દ ખલીફાએ બરહક વ ઈમામે મુત્લક હજરતે સચ્ચિદુના અબૂ બક સિદ્દીક, ફિર હજરતે ઉમર ફારૂક, ફિર હજરતે ઉસ્માને ગની, ફિર હજરતે મૌલા અલી ફિર છ<sup>6</sup> મહીને કે લિયે હજરતે ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمْ હુએ, ઈન હજરાત કો ખુ-લફાએ રાશિદીન ઔર ઈન કી બિલાફત કો બિલાફતે રાશિદા કહતે હૈનું.

(બહારે શરીઅત, જિ. 1, સ. 241)

ફરમાને મુસ્તકા : تَعَالَى اللَّهُ عَنِ الْمَوْتَمُ  
તુમ જહાં ભી હો મુજ પર હૃદાદ પણો, કે તુમદારા હૃદાદ મુજ તક  
પહોંચોયો હો. (طبراني)

## ﴿11﴾ એ અલ્લાહ ! મૈં ઈસ સે મહાબત કરતા હું

હજરતે સાચ્છિદુના બરાઅ બિન આજિબ ફરમાતે હું  
કે મૈં ને દેખા કે નૂર કે પૈકર, તમામ નબિયોં કે સરવર  
કો (رضي الله تعالى عنهما) ઈમામે હસન બિન અલી (رضي الله تعالى عنهما) કંન્ધે  
પર ઉઠાએ હુએ  
હુંતૂ ભી ઈસ સે મહાબત ફરમા. (ترمذى ج ٥ ص ٤٣٢ حدیث ٤٣٢)

યા હસન ! અપની મહાબત દીક્ષિયે !

ઇશ્ક મેં અપને હમેં ગુમ કીક્ષિયે

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى مُحَمَّدٍ

## ﴿12﴾ મુન્જે કી પૈદાધશ

આરિઝ બિલ્લાહ, હજરતે સાચ્છિદુના નૂરુદ્ડીન અબ્દુર્રહ્માન જામી  
(فَدِس سُرُّه السَّامِيٌّ) વફાત : 989 હિ.) નકલ ફરમાતે હું : એક મર્તબા હજરતે  
સાચ્છિદુના ઈમામે હસન મુજતબા હજ કે મૌકાએ પર મક્કતુલ  
મુકર્મા (زَادَهَا اللَّهُ شُرُقًا وَتَعْظِيمًا) પૈદલ તશરીફ લે જા રહે થે કે દૌરાને સફર આપ  
કે પાઉ મુબારક મેં સૂજન આ ગઈ, ગુલામ ને અર્જ કી : હુંગૂર ! કિસી સુવારી  
પર સુવાર હો જાઈયે તાકે કદમોં કી સૂજન કમ હો જાએ, ઈમામે હસન  
મુજતબા (رضي الله تعالى عنه) ને ગુલામ કી દર-ખવાસ્ત કબૂલ ન કી ઓર ફરમાયા :  
જબ અપની મન્જિલ પર પહોંચો તો વહાં તુમ્હેં એક ઉબશી મિલેગા, ઉસ કે

ફરમાને મુસ્તફા : ﷺ : જો લોગું અપની મજલિસ સે અલ્લાહ કે જિક ઔર નભી પર હુરુદ શરીર પદે કિગેર ઉઠ ગયે તો વોહ બદબૂદાર મુદ્દાર સે ઉઠે. (شعب الائمه)

પાસ તેલ હોગા, તુમ ઉસ સે વોહ તેલ ખરીદ લેના. આપ રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> કે ગુલામ ને કહા : મેરે માં બાપ આપ પર કુરબાન ! હમ ને કિસી ભી જગહ કોઈ એસા આદમી નહીં દેખા જિસ કે પાસ એસી દવા હો. ઈસ જગહ કહાં દસ્ત-યાબ હોગી ? જબ વોહ અપની મન્જીલ પર પહોંચે તો વોહ હબશી દિખાઈ દિયા. ઈમામે હસન મુજજ્જતબા રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> ને ફરમાયા : યેહ વોહી હબશી હૈ જિસ કે બારે મેં તુમ સે કહા થા, જાઓ ઉસ સે તેલ ખરીદો ઔર કીમત અદા કરો. ગુલામ જબ તેલ ખરીદને કે લિયે હબશી કે પાસ ગયા ઔર તેલ કા પૂછા તો હબશી ને પૂછા : કિસ કે લિયે ખરીદ રહે હો ? ગુલામ ને કહા : ઈમામે હસન મુજજ્જતબા રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> કે લિયે. હબશી ને કહા : મુજ્જે ઈમામે હસન મુજજ્જતબા રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> કે પાસ લે ચલો, મૈં ઉન કા ગુલામ હું. જબ હબશી હજરતે ઈમામે હસન મુજજ્જતબા રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> કે પાસ આયા તો અર્જ કી : હુજૂર ! મૈં આપ કા ગુલામ હું, આપ સે તેલ કી કીમત નહીં લુંગા, મેરી બીવી દર્દે જેહ મેં મુખ્તલા હૈ, હુઆ ફરમાએં કે અલ્લાહ ગ્રેજુલ આફિયત કે સાથ ઔલાદ અતા ફરમાએ. હજરત ઈમામે હસન મુજજ્જતબા રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> ને ફરમાયા : ઘર જાઓ, અલ્લાહ તુમ્હેં વૈસા હી બચ્યા અતા ફરમાએગા જૈસા તુમ ચાહતે હો ઔર વોહ હમારા પૈરવ-કાર રહેગા. હબશી ઘર પહોંચા તો ઘર કી હાલત વૈસી હી પાઈ જૈસી ઉસ ને ઈમામે હસન મુજજ્જતબા રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ<sup>رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ</sup> સે સુની થી.

(شوادن التبوب من ٢٢٧)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى الْحَبِيبِ!

ફરમાને મુસલ્ફા : ﷺ : જિસ ને મુજ પર રોજે જુમુઆ દો સો બાર હુરુદે પાક પઢા ઉસ કે દો સો સાલ કે શુનાડ મુઅસાફ હોંગે. (معجم الجواب)

### ﴿13﴾ સુરમા વ ખુશભૂ સે મેહમાની

રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ أَمْبَانِيનَ حَزَرَتِ سَبِيلِهِ  
અમીરુલ મુઅમિનીન હજરતે સચ્ચિદુના (ઉસ્માને ગની) ને નિકાષ કી દા'વત મેં શિર્કત કે લિયે (હજરતે સચ્ચિદુના ઈમામ) હસન બિન અલી રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કો પૈગામ લિજવાયા. જબ આપ રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને અપને સાથ મસ્નાદ પર બિઠાયા. હજરતે સચ્ચિદુના ઈમામે હસન રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને બતાયા : મેરા રોજા હૈ, અગર મેરે ઈલભ મેં યેહ બાત પહુલે આ જાતી કે આપ દા'વત ફરમાએંગે તો મેં (નફલ) રોજા ન રખતા. હજરતે સચ્ચિદુના ઉસ્માને ગની રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને ઈશ્વાર ફરમાયા : આપ ચાહેં તો આપ રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કે લિયે વોહી એહતિમામ કિયા જાએ જો એક રોજેદાર કે લિયે કિયા જાતા હૈ. હજરતે સચ્ચિદુના ઈમામે હસન રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને પૂછ્યા : રોજાદાર કે લિયે ક્યા એહતિમામ કિયા જાતા હૈ ? ઈશ્વાર ફરમાયા : “વોહ યેહ કે રોજાદાર કો સુરમા ઔર ખુશભૂ લગાઈ જાએ.” ફિર અમીરુલ મુઅમિનીન હજરતે સચ્ચિદુના (ઉસ્માને ગની) રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને સુરમા ઔર ખુશભૂ મંગવાઈ ઔર આપ રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કો યેહ દોનોં ચીજેં લગાઈ ગઈ.

(تاریخ المدینۃ المنورۃ، جزء ۳، ص ۱۸۴)

એ આશિકાને સહાબા વ અહલે બેત ! ઈસ છિકાયત સે હમેં યેહ મ-દની કૂલ હાસિલ હુવા : અગર મુસલ્માન પહુલે સે ખાને કી દા'વત દે તો મૌકાએ કી મુના-સબત સે ઉસ કી દિલજૂર્દી કી ખાતિર રોજાએ નફલ તર્ક કર દેના મુનાસિબ હૈ.

صَلُوٰ عَلَى الْحَبِيبِ ! صَلُوٰ عَلَى اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ફરમાને મુસ્તફા : ﷺ : مُوجٌ پર દુરદ શરીર પડો, અલ્લાહ તુમ પર રહમત ભેઝેગા॥ (ابن عدી)

## ﴿14﴾ બચપન મેં હદીસ સુન કર યાદ કર લી

તાબેઈ બુગ્ગો હજરતે સચ્ચિદુના અબુલ હવરાઅ રહ્મતુલ્લાહ ઉદ્દેશ્યે  
ફરમાતે હૈનું : મૈં ને હજરતે સચ્ચિદુના ઈમામે હસન બિન અલી રહ્મતુલ્લાહ  
સે પૂછા : આપ કો રસૂલુલ્લાહ ﷺ સે સુની હુઈ કોઈ  
હદીસ યાદ હૈ ? ફરમાયા : યેહ હદીસ યાદ હૈ કે (બચપન મેં) એક મર્તબા મૈં  
ને સ-દકે (યા'ની ઝકાત) કી ખજૂરોમાં સે એક ખજૂર ઉઠા કર મુંહ મેં ડાલ  
લી તો નાનાજાન, રહમતે આ-લમિયાન રહ્મતુલ્લાહ ઉદ્દેશ્યે  
સે વોહ ખજૂર નિકાલી ઔર સ-દકે કી ખજૂરોમાં વાપસ રખ દી. અર્જ કી  
ગઈ : યા રસૂલુલ્લાહ ! અગર એક ખજૂર ઈન્હોંને  
ઉઠા લી તો ઈસ મેં ક્યા હરજ હૈ ? યારે આકા, મક્કી મ-દની મુસ્તફા  
ઇન્નાલُ مُحَمَّدٌ لَا تَحْلُلْ لَنَا الصَّدَقَةُ : ને ઈશાં ફરમાયા :  
યા'ની હમ આલે મુહમ્મદ કે લિયે સ-દકે કા માલ હલાલ નહીં હૈ.

(اسد الغابة ج ٢ ص ١٦)

મુફસ્સિસરે શહીર હકીમુલ ઉમ્મત મુફતી અહમદ યાર ખાન  
મિરઆત જિલ્દ 3 સફ્ફા 46 પર લિખતે હૈનું : “અપની ના  
સમજ ઔલાદ કો ભી ના જાઈજ કામ ન કરને હૈ. વોહ દેખો ! હજરતે  
હસન (રહ્મતુલ્લાહ ઉદ્દેશ્યે) ઉસ વકત બહુત હી કમસ્સિન (યા'ની કમ ઉમ્મ) થે  
મગર હુગ્ગોરે અન્વર ને ઉન્હેં ભી ઝકાત કા છુહારા  
(યા'ની સૂખી ખજૂર) ન ખાને દિયા.”

ફરમાને મુસ્તફા : ﷺ : મુજ પર કસરત સે હુરુદે પાક પઠો બેશક તુમ્હારા મુજ પર હુરુદે પાક  
પઢના તુમ્હારે ગુનાંડોં કે લિયે મિઝિરત હો. (ابن ઉસ્કર)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દો જહાં કે તાજવર, સુલ્તાને બહરો  
બર ચીલી અપને પ્રારે નવાસે સચ્ચિદુના ઈમામે હસન  
દી રૂફુલુલુલી કી. કેસી પ્રારી તરબિયત ફરમાઈ ! ઈસ રિવાયત મેં હમારે  
લિયે યેહ મ-દની ફૂલ હૈ કે બચ્ચોં કી તરબિયત ઈબ્જિદાઈ ઉમ્ર સે હી કરની  
ચાહિયે. ઉમ્મુમન દેખા જાતા હૈ કે વાલિદેન બચ્ચે કી તરબિયત કા સહીહ  
હક અદા નહીં કરતે ઔર બચપન મેં અચ્છે બુરે કી તમીજ નહીં સિખાતે  
ઔર જબ વોહી ઔલાદ બડી હો જાતી હૈ તો ફિર ઐસે વાલિદેન અપની  
ઔલાદ કી ના ફરમાની કા રોના રોતે નજર આતે હૈન. માં બાપ કો ચાહિયે  
કે બચપન હી સે અપની ઔલાદ કી તરબિયત શરીરાત વ સુન્નત કે મુતાબિક  
કરેં. બચ્ચા સમજ કર ઉન્હેં છૂટ ન દેં ઔર ન યેહ કહ કર ઉન કી તરબિયત  
કો નજર અન્દાજ કરેં કે અભી તો બચ્ચા હૈ જબ બડા હોગા તો ખુદ સમજ  
જાએગા.

### બચ્ચોં કો અચ્છા અદબ સિખાઓ

બચ્ચોં કી અચ્છી તરબિયત કે મુ-તાલિક ફરમાને મુસ્તફા  
ચીલી હૈ : અપની ઔલાદ કે સાથ હુસ્ને સુલૂક કરો ઔર ઉન્હેં  
અચ્છા અદબ સિખાઓ. (ابن ماج્હ ٤، حદિથ ١٨٩)

### તુમ સે તુમ્હારી ઔલાદ કે બારે મેં પૂછા જાએગા

હજરતે સચ્ચિદુના અધ્બુત્લાહ બિન ઉમર ને એક  
શાખસ સે ફરમાયા : અપને બચ્ચે કી અચ્છી તરબિયત કરો ક્યું કે તુમ સે

ફરમાને મુશ્કેલ : ﷺ : કિસ ને ડિતાબ મેં મુજ પર હુર્રે પાક વિખા તો જબ તક મેરા નામ ઉસ મેં રહેગા ફિરિશે ઉસ કે લિયે ઈસ્તિજ્ફાર (યાંની બાણિજા કી હુઅા) કરતે રહેંગે. (બ્રાની)

તુમ્હારી ઔલાદ કે બારે મેં પૂછા જાએગા કે તુમ ને ઉસ કી કેસી તરબિયત કી ઓર તુમ ને ઉસે ક્યા સિખાયા? (شعب الایمان ج ٦ ص ٤٠٠ حديث ملخصاً)  
 ખૂબ મિટે બેકાર બાતોં કી, રહે  
 લખ પે લિકુલ્લાહ મેરે દમ બદમ

**صَلُّوا عَلَى الْحَبِيبِ!**

### ﴿15﴾ હાથો હાથ ઝરત પૂરી કર દી

હજરતે સાચ્છિદુના ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કી બિદમત મેં એક સાઈલ ને હાજિર હો કર તહરીરી દર-ખવાસ્ત પેશ કી. આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને બિગેર પઢે ફરમાયા : તુમ્હારી ઝરત પૂરી કી જાએગી. અર્જ કી ગઈ : એ નવાસએ રસૂલ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ! આપ ને ઉસ દર-ખવાસ્ત પઢ કર જવાબ દિયા હોતા. ઈશારા ફરમાયા : જબ તક મેં ઉસ કી દર-ખવાસ્ત પઢતા વોહ મેરે સામને કિલ્લત કી હાલત મેં ખડા રહતા ફિર અગર અલ્લાહ ગુરૂજ جَلَّ جَلَّ મુજ સે પૂછતા કે તૂને સાઈલ કો ઈતની દેર ખડા રખ કર ક્યું જલીલ કિયા ? તો મૈં ક્યા જવાબ દેતા ? (احياء العلوم ج ٣ ص ٣٤)

**صَلُّوا عَلَى الْحَبِيبِ!**

### ﴿16﴾ દસ હજાર દિરહમ સે નવાજ દિયા

હજરતે સાચ્છિદુના ઈમામે હસન رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કે પહ્લુ મેં બૈઠ કર એક આદમી એક બાર અલ્લાહ جَلَّ جَلَّ સે દસ હજાર દિરહમ કા સુવાલ કર રહા થા, જેસે હી આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને ઉસ હાજત મન્દ કી યેહ હુઅા સુની

ફરમાને મુસનદા : ﷺ : જો મુજ પર એક દિન મેં 50 બાર દુર્ગત પાક પદે ડિયામત કે દિન મેં (ઉસ સે મુસા-ફલ કરું) યા'ની લાય મિલાઓ। (ابن બશ્કોલ)

તો ફૈરન અપને ઘર તશરીફ લાએ ઔર ઉસ શખ્સ કે લિયે 10 હજાર દિરહમ ભિજવા દિયે.

(ابن عસ્કર્જ ١٣ ص ٢٤٥)

મેરા દિલ કરતા હૈ મૈં ભી હજ કરું

હો અતા જાએ સફર ચશ્મે કરમ !

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ

### ﴿17﴾ હાજુ પર એહસાન કરને વાલે બાણી દિયે જતે હૈનું

હજરતે સચ્ચિદાના અબૂ હારુન રહ્માતે હૈનું : એક મર્તબા હમ હજ કે ઈરાટ સે નિકલે, જબ મદીનતુલ મુનવ્વરહ રફતુલ્લાહ પહુંચે તો (હજરતે સચ્ચિદાના ઈમામે) હસન કી જિયારત કે લિયે ભી હાજિર હુએ, સલામ વ દુઆ કે બા'દ સફરે હજ કે હાલાત અર્જ કિયે. જબ હમ વાપસ આને લગે તો (સચ્ચિદાના ઈમામ) હસન ને રકમ લાને વાલે સાહિબ સે કહા : હમ તો માલદાર વ દૌલત મન્દ હૈનું, હમેં ઈસ કી હાજત નહીં. ઉસ ને કહા : આપ હજરત (ઈમામે) હસન રફતુલ્લાહ કી ભલાઈ કો વાપસ ન લૌટાઈયે. ફિર હમ (હજરતે સચ્ચિદાના ઈમામે) હસન કી ખિદમતે બા બ-ર-કત મેં હાજિર હુએ ઔર અપની માલદારી કે બારે મેં અર્જ કિયા. ફરમાયા : મેરે અ-મલે ઐર (યા'ની ભલાઈ કે કામ) કો વાપસ મત કીજિયે, અગર મેરી મૌજૂદા હાલત ઐસી ન હોતી તો યેહ (રકમ કબૂલ ન કરના) તુમ્હારે લિયે આસાન હોતા, મૈં તો

ફરમાને મુશ્ટકફા : ﷺ : બરોજે કિયામત લોગોં મેં સે મેરે કરીબ તર વોહ હોગા જિસ ને હુન્યા મેં મુજ પર જિયાદા દુહેટે પાક પઢે હોંગે. (તરમણી)

આપ હજરાત કો જાએ રાહ પેશ કર રહા હું, અદ્દાહ ગુર્જાલ અરહે કે દિન અપને બન્દોં કે મુન્તાલ્લિક ફિરિશ્તોં કે સામને ફખ્ર ફરમાતે હુએ ઈર્શાદ ફરમાતા હૈ : મેરે બન્દે પરાગન્દા હાલ (યા'ની હૈરાનો પરેશાન) મેરી બારગાહ મેં રહમત કે સુવાલી બન કર હાજિર હોય, મૈં તુમ્હેં ગવાહ બનાતા હું કે મૈં ને ઈન પર એહસાન કરને વાલે કો બખ્શ દિયા, ઈન સે બુરા સુલૂક કરને વાલે કે હક મેં ઈન કે મોહસિન (યા'ની એહસાન કરને વાલે) કી શફાઅત કબૂલ કી. અદ્દાહ ગુર્જાલ જુમુએ કે દિન ભી ઈસી તરહ ફરમાતા હૈ.

(ابن عસ્કર જ ١٣ ص ٢٤٨)

صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلُّوٰ اللّٰهُ تَعَالٰى عَلٰى عَلِيٍّ مُحَمَّدٍ

### ﴿18﴾ મેહમાન નવમી બુટિયા

હસને કરીમૈન (યા'ની હસન વ હુસૈન) ઔર અબુલ્લાહ ઈબ્ને જા'ફર رضી اللہ تَعَالٰی عَنْهُمْ أَجْمَعُينું તીનો છજ કે લિયે જા રહે થે, ખાને પીને ઔર સામાન કા ઊંટ બહુત પીછે રહ ગયા થા. ભૂક ઘાસ સે બેતાબ હો કર યેહ સાહિબાન રાસ્તે મેં એક બુટિયા કે જૈમે (CAMP) પર ગાંને ઔર ઉસ સે ફરમાયા : હમ કો ઘાસ લગ્ની હૈ. ઉસ ને એક બકરી કા દૂધ નિકાલ કર ઈન તીનો કો પેશ કિયા. દૂધ પી કર ઈન્હોંને ફરમાયા : કુછ ખાને કે લિયે લાઓ ! બુટિયા ને કહા કે ખાને કો તો કુછ મૌજૂદ નહીં હૈ આપ ઈસી બકરી કો જાખ કર કે ખા લાલીજિયે. ઈન સાહિબાન ને ઐસા હી કિયા, ખાને પીને સે ફારિગ હો કર ઈન્હોંને કહા : હમ કુરૈશી હું જબ સફર સે વાપસ આઓંગે તો તુમ હમારે પાસ આના હમ તુમ્હારે ઈસ એહસાન કા બદલા દેંગે. યેહ કહ કર

કરમાને મુસ્તફા ﷺ : જિસ ને મુજ પર એક મર્તબા હુરુદ પણ અલ્લાહ ઉસ પર દસ રહમતે ભેજતા ઔર ઉસ કે નામથે આ 'માલ મેં દસ નેત્રિયાં લિખતા હૈ. (ત્રણી)

યેહ તીનોં સાહિબાન આગે રવાના હો ગયે, જબ ઉસ બુઢિયા કા શોહર આયા તો નારાજ હુવા કે તૂને બકરી ઐસે લોગોં કી ખાતિર ઝબ્બ કરા દી જિન સે ન હમારી વાકિફિય્યત થી ઔર ન દોસ્તી. ઈસ વાકિએ કો કુછ મુદ્દત ગુજર ગઈ. ઉસ બુઢિયા ઔર ઉસ કે ખાવન્દ કો મદ્દીનતુલ મુનવ્વરહ જાને કી જરૂરત પડી, વોહ વહાં પહોંચે ઔર ઊંટ કી મીઞિયાં ચુન ચુન કર બેચને લગે (તાકે અપના પેટ ભર સકે). એક દિન યેહ બુઢિયા કહીં જા રહી થી હજરતે સચ્ચિદાનાના ઈમામે હસન મુજતબા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કે મકાને આલીશાન કે કરીબ સે ગુજરી ઉસ વકત આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** દરવાજે પર ખડે થે. બુઢિયા પર જું હી નજર પડી ઉસ કો પહ્યાન લિયા ઔર ઉસ સે ફરમાયા : એ ખાતૂન ! આપ મુજે પહ્યાનતી હોય ? ઉસ ને કહા : નહીં. આપ ને ફરમાયા : મૈં વોહી હું જો કુલાં રોજ તુમહારા મેહમાન હુવા થા. ઉસ ને કહા : અચ્છા આપ વોહ હોય ? ઈસ કે બા'દ આપ ને ઉસ બુઢિયા કો એક હજાર બકરિયાં ઔર એક હજાર દીનાર અતા ફરમાએ ઔર અપને ગુલામ કે હમરાહ ઉસ કો હજરતે સચ્ચિદાનાના ઈમામે હુસૈન **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કે પાસ ભેજા. આપ ને બુઢિયા સે પૂછા : એ ખાતૂન ! મેરે ભાઈ સાહિબ ને આપ કો કયા હિયા ? ઉસ ને કહા : એક હજાર બકરિયાં ઔર એક હજાર દીનાર અતા ફરમાએ હોય. હજરતે સચ્ચિદાનાના ઈમામે હુસૈન **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ને ભી ઈસી કદર ઈન્નામ ઉસ કો હિયા ઔર અપને ગુલામ કે હમરાહ હજરતે સચ્ચિદાના અબુલ્લાહ ઈઝે જા'ફર **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કે પાસ ભેજા. ઉન્હોંને બુઢિયા સે દરયાફત કિયા : હ-સનૈને

ફરમાને મુસ્તફા : ﷺ : શબે જુમુઆ ઔર રોજે જુમુઆ મુઝ પર દુરુદ કી કસરત કર લિયા કરો જો એસા કરેગા કિયામત કે દિન મૈં ઉસ કા શરીર વ ગવાહ બનુંશા. (شعب الإيمان)

કરીમેન **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمَا** ને આપ કો કિતના માલ દિયા હૈ ? ઉસ ને કહા : દોનોં હઝરાત ને દો હઝરાર બકરિયાં ઔર દો હઝરાર દીનાર ઈનાયત ફરમાએ હૈને. હજરતે સાચ્છિદુના અધ્યાત્માહ ઇબ્ને જા'ફર **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ને ભી ઉસ કો દો હઝરાર દીનાર ઔર દો હઝરાર બકરિયાં અતા ફરમાઈ. યું વોહ ખુદિયા ચાર હઝરાર બકરિયાં ઔર ચાર હઝરાર દીનાર લે કર અપને શોહર કે પાસ પહોંચ્યી. (احياء العلوم ج ٣ ص ٣٠٧)

**صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

### ﴿19﴾ સબ કુછ ઐરાત કર દિયા

રાકિબે દોશે મુસ્તફા, સાચ્છિદુલ અસ્થિયા હજરતે સાચ્છિદુના ઈમામે હસન મુજતબા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ને દો બાર અપને ઘર કા સારા ઔર તીન મર્તબા આધા માલ વ અસ્થાબ રાહે ખુદા મેં ખર્ચ ફરમાયા.

(حلية الأولياء، ج ٢ ص ٤٧)

એ સખી ઇબ્ને સખી અપની સખા  
સે દો લિસ્સા સાચ્છિદે આલી હશમ

**صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

### ﴿20﴾ શોકે તિલાવત

નવાસએ રસૂલ, ચ-મને મુર્તજા કે જન્તતી ફૂલ, જિગર ગોશએ બતૂલ સાચ્છિદુના ઈમામે હસન મુજતબા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** હર રાત સૂ-રતુલ કહુફ કી તિલાવત ફરમાયા કરતે થે. યેહ મુબારક સૂરત એક તખ્તી પર તિખી હુંદી થી, આપ અપની **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** જિસ જોજા કે પાસ તશરીફ લે

ફરમાને મુસન્ફુ : ﷺ : أَوْ مُعَاوِيَةَ بْنَ سَعْدٍ : أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ تَعَالَى عَنْهُ وَسَلَّمَ : كُلُّ شَيْءٍ لِلَّهِ تَعَالَى عَنْهُ وَمَا يَرِيدُ  
અજ લિખતા હૈ ઔર કીરત ઉહુદ પછાડ જિતતા હૈ. (بයદિલરજા)

જાતે યેહ મુખ્યારક તપ્તી ભી આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કે ફરમાણ હોતી.

(شعب الایمان ج ٢ ص ٤٧٥ حديث ٤٤٤٧)

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى الْحَبِيبِ !**

## ﴿21﴾ મા'મૂલાતે ઇમામે હસન

હજરતે સાચિદુના અબૂ સઈદ ફરમાતે હૈ : હજરતે સાચિદુના અમીરે મુઆવિયા **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ને એક બાર મદીનતુલ મુનવ્વરહ માટે રાધી કુરૈશી શાખસ સે સાચિદુના ઈમામ હસન બિન અલી **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કે મુ-તાલિક દરયાફત ફરમાયા તો ઉસ ને અર્જ કી : એ અમીરુલ મુઅમિનીન ! વોહ નમાજે ફજ અદા ફરમાને કે બા'દ સૂરજ તુલુઅ હોને તક મસ્જિદુન-બવિયિશશરીફ **عَلَى صَاحِبِهِ الْصَّلَاةُ وَالسَّلَامُ** હી મેં તશરીફ ફરમા રહેતે હૈન. ફિર મુલાકાત કે લિયે આએ હુએ મુઅઝુઝીન સે મુલાકાત વ ગુફત-ગૂ ફરમાતે યણાં તક કે કુછ દિન નિકલ આતા, અબ દો રકાત નમાજ અદા ફરમાતે, ઈસ કે બા'દ ઉમ્મહાતુલ મુઅમિનીન કી બારગાહ મેં હાજિરી દેતે, સલામ પેશ ફરમાતે, બા'જ અવકાત ઉમ્મહાતુલ મુઅમિનીન **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** આપ કોઈ ચીજ તોહુફતન પેશ ફરમાતીં. ઈસ કે બા'દ આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** અપને ઘર તશરીફ લે આતે. આપ શામ કે વકત ભી યુંધી કિયા કરતે થે. ફિર ઉસ કુરૈશી આદમી ને કહા : હમ મેં કોઈ ભી ઉન કા હમ-મર્તબા નહીં. (ابن عસ્કરજ ١٣ ص ٢٤١)

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى الْحَبِيبِ !**

ફરમાને મુસ્તફા : ﷺ جب تુમ રસૂલોं પર હૃદાં પઢો તો મુજ પર ભી પઢો, બેશક મૈં તમામ જહાનોં કે રખ કા રસૂલ હું. (جمع الجواب)

## ﴿22﴾ મદીના તા મક્કા 20 બાર પૈદલ સફર

હજરતે સચ્ચિદુના મુહુમ્મદ બિન અલી رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ફરમાતે હું : હજરતે સચ્ચિદુના ઈમામે હસન رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને ફરમાયા : મુજે હયા આતી હે કે મૈં અપને રખ غَرَوْجَلٌ સે ઈસ હાલ મેં મુલાકાત કરું કે ઉસ કે ઘર કી તરફ કબી ન ચલા હું. ચુનાન્યે આપ 20 رَفِيقُ اللَّهِ تَعَالَى عَنْهُ બાર મદીનતુલ મુનવ્વરાએ રાદેહા લીધા શર્فારૂં મુકર્મા رَأَدَهَا اللَّهُ شَرَفًا وَرَعِظَيْمًا કી જિયારત કે લિયે હાજીર હુંએ. (حلીة الأولياء ج ٢ ص ٤٦ رقم ١٤٣١)

**صَلُّوا عَلَى الْحَبِيبِ!**

## ﴿23﴾ ગુલામ આપાદ કર દિયા

હજરતે સચ્ચિદુના ઈમામે હસન મુજતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ એક મર્તબા ચન્દ મેહમાનોં કે સાથ ખાના ખા રહે થે, ગુલામ ગર્મ ગર્મ શોરબે કા પિયાલા દસ્તર ખ્વાન પર લા રહા થા કે ઉસ કે હાથ સે પિયાલા ગિરા જિસ કી વજહ સે શોરબે કે છીટે આપ رَفِيقُ اللَّهِ تَعَالَى عَنْهُ પર ભી આએ. યેહ દેખ કર ગુલામ ઘબરાયા ઔર શરમિન્દગી ભરે લહજે મેં ઉસ ને સૂરાએ આલે ઈમરાન કી આયત નમ્બર 134 કા યેહ હિસ્સા તિલાવત કિયા : **وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ** يَا مَنِ اتَّخَذَ إِلَهًا مِنْ دُرْجَةِ آنِيهِ فَلَا يَنْعَلِمُ بِمَا فِي أَعْيُنِ النَّاسِ સે દર ગુજર કરને વાલે.” આપ رَفِيقُ اللَّهِ تَعَالَى عَنْهُ ને ફરમાયા : મૈં ને મુઆફ કિયા. ગુલામ ને ફિર ઈસી આયત કા આભિરી હિસ્સા પઢા : **وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ** يَا مَنِ اتَّخَذَ إِلَهًا مِنْ دُرْجَةِ آنِيهِ فَلَا يَنْعَلِمُ بِمَا فِي أَعْيُنِ النَّاسِ આપ

ફરમાને મુસફિફ : مُعَذَّبٌ بِمَا فَعَلَ عَنْهُ اللَّهُ تَعَالَى وَمُؤْمِنٌ بِمَا فَعَلَ عَنْهُ اللَّهُ تَعَالَى : ﴿كُلُّ نَاسٍ كُلُّهُ لِلَّهِ الْعَلِيِّ بِمَا فَعَلَ وَمَنْ يُؤْمِنْ بِهِ فَأُولَئِكَ هُمُ الْمُسْلِمُونَ﴾ (فريدون الأخبار)

ફરમાયા : મૈં ને તુઝે અલ્લાહ તચાલા કી ખુશનૂદી કે લિયે આગાંડ કિયા। (روح البيان ج ٢ ص ٩٥ ملخصا)

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

### ﴿24﴾ આગાર એક કાન મેં ગાલી ઓર દૂસરે.....

હિત્તાતે સાચ્છિદુના ઈમામે હસન મુજજ્જતબા ફરમાતે હોય : رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ فَرِجَانُهُ فِي أَذْنِي هَذِهِ، وَأَغْتَدَرَ إِلَيَّ فِي أَذْنِي الْأُخْرَى لَقِيلَثُ عَذْرَهُ - لَوْأَنَّ رَجُلًا شَتَمَنِي فِي أَذْنِي هَذِهِ، وَأَغْتَدَرَ إِلَيَّ فِي أَذْنِي الْأُخْرَى لَقِيلَثُ عَذْرَهُ - યા'ની અગાર કોઈ મેરે એક કાન મેં ગાલી દે ઓર દૂસરે કાન મેં મુઆફી માંગ લેતો મૈં જરૂર ઉસ કી મા'ਜિરત કબૂલ કરુંગા.

(بهجة المجالس وانس المجالس لابن عبد البر ج ٢ ص ٤٨٦)

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

### ﴿25﴾ નમામ કે વકત રંગ બદલ જાતા

હિત્તાતે સાચ્છિદુના ઈમામે હસન મુજજ્જતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ જુંધી વુગ્ઝ કર કે ફારિગ હોતે આપ કા રંગ બદલ જાતા. ઈસ કી વજહ પૂછને પર ફરમાયા : જો શાખ્સ માલિકે અર્શ (યા'ની અલ્લાહ કી) બારગાહ મેં હાજિરી કા ઈરાદા કરે તો હક યેહી હે કે ઉસ કા રંગ બદલ જાઓ.

(وفيات الاعيان ج ٢ ص ٥٦)

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

### ﴿26﴾ કુતે પર શફ્કત કરને વાતા બા કમાલ ગુલામ

હિત્તાતે સાચ્છિદુના ઈમામે હસન મુજજ્જતબા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને

**કરાને મુસાફિ** ﷺ : શબે જુમુઆ ઓર રોઝે જુમુઆ મુજ પર કસરત સે હૃદદ પઢો કયું  
તુમ્હારા હૃદદ મુજ પર પેશ કર્યા જતા હૈ. (طبراني)

મદ્દીનતુલ મુનવ્વરહ કે એક બાગ મેં એક ઐસે સિયાદ  
ફામ (યા'ની કાલે) ગુલામ કો દેખા જો એક લુકમા ખુદ ખાતા ઔર એક  
અપને કુતે કો ખિલાતા. આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ઉસ કે પાસ તશરીફ લાયે  
ઔર ફરમાયા : તુમ્હે ઈસ બાત પે કિસ ને ઉભારા ? ઉસ ને અર્જ કી : મુઝે  
ઈસ બાત સે હયા (યા'ની શર્મી) આતી હું કે ખુદ તો ખાઉં લેકિન ઈસે ન  
ખિલાઉં. આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કો યેહ બાત બહુત પસન્દ આઈ ઉસ સે ઈશ્રાદ  
ફરમાયા : મેરી વાપસી તક યહી ઠહરના. યેહ ફરમા કર આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ**  
ઉસ કે માલિક કે પાસ તશરીફ લે ગયે ઔર ઉસ સે વોહ ગુલામ ઔર  
બાગ ખરીદ ફરમાયા ઔર ગુલામ કો આગાદ ફરમા કર બાગ ઉસ કો  
તોહફે મેં દે હિયા. ગુલામ ભી અકલ મન્દ થા ઔર રાહે ખુદા મેં ખર્ચ  
કરને કી અહભિષ્યત સે આગાહ થા, લિધાજા ઉસ ને ફૌરન અર્જ કી :  
**يَامُولَىٰ إِقْدَ وَهُبْتُ الْحَائِطَ لِلَّذِي وَهَبْتُنِي لَهُ** યા'ની એ મેરે આકા ! મેં ઈસ  
બાગ કો ઉસી કી રિઝા (યા'ની ખુશનૂદી) કી ખાતિર હિબા (Gift) કરતા હું જિસ  
કી રિઝા કે લિયે આપ ને મુજે યેહ અતા ફરમાયા હૈ.

(تاریخ بغداد ج ٦ ص ٣٣ رقم ٣٠٥٩)

صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ صَلَوَاتُ اللَّهِ عَلَى الْحَبِيبِ

## ੴ 27 ਇਮਾਮੇ ਹਸਨ ਮੁਜਤਬਾ ਕਾ ਖ਼ਾਬ

કરમાને મુસ્તફા : ﷺ : જિસ ને મુજ પર એક બાર હુર્દે પાક પઢા અલ્લાહ ઉંગલ ઉસ પર દસ રહ્મતોં ભેજતા હૈ. (مسلم)

હૈ. આપ રَغْفَى اللَّهُ تَعَالَى عَنْ ને યેહ ખુશ ખબરી અપને અહલે બૈત કો સુનાઈ. ઉન્હોંને જબ યેહ વાકિઅા તાબેઈ ખુર્ગુર્જ હજરતે સચ્ચિદુના સઈદ બિન મુસયબ રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કે સામને બયાન કિયા તો આપ રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ને કરમાયા : અગર વાકેઈ યેહ ખવાબ દેખા હૈ તો ઈન કી ઉત્ત્ર કે ચન્દ હી દિન બાકી રહ ગયે હૈન. ઈસ વાકિઅે કે કુછ દિન હી બા'દ ઈમામે હસન મુજતબા રَغْفَى اللَّهُ تَعَالَى عَنْ કા વિસાલ હો ગયા. (الطبقات الكبير لابن سعد ج ٦ ص ٣٨٦ رقم ٧٣٧٩)

**صَلُوٰ عَلَى الْحَبِيبِ ! صَلُوٰ عَلَى الْحَبِيبِ !**

### ﴿28﴾ ઔસી માલ્ક પહ્લે કબી નાહીં દેખી

વફાત કે કરીબ હજરતે સચ્ચિદુના ઈમામે હુસૈન ને દેખા કે સચ્ચિદુના ઈમામે હસન મુજતબા રَغْفَى اللَّهُ تَعَالَى عَنْ કો ઘબરાહટ હો રહી હૈ. આપ રَغْفَى اللَّهُ تَعَالَى عَنْ ને ઉન કી તસ્કીન કે લિયે અર્જ કિયા : ભાઈજાન ! આપ કયું રાન્ધા હૈન ? રસૂલુલ્હાહ ચَلُوٰ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઔર હજરતે અલી કી ખિદમત મેં આપ કો અન્કરીબ હાજિરી કી સાચાદત નસીબ હોગી ઔર વોહ દોનોં આપ કે આબાસ (નાનાજાન ઔર અભૂજાન) હૈન, ઔર હજરતે ખદી-જતુલ કુબ્રા, હજરતે ફાતિમા ઝડરા રَغْفَى اللَّهُ تَعَالَى عَنْહُمَا કા દીદાર નસીબ હોગા ઔર વોહ આપ કે મામૂં હૈન ઔર હજરતે હમ્રા વ જા'ફર રَغْفَى اللَّهُ تَعَالَى عَنْહُمَا સે મુલાકાત હોગી ઔર વોહ આપ કે ચચા હૈન. હજરતે

फरमाने मुस्तकः : عَلَيْهِ تَعَالَى اللَّهُ عَنْهُ وَسَلَامٌ (उस शास्त्र की नाक खाक आलूद हो जिस के पास मेरा जिक हो और वोह मुझ पर हुड़े पाक न पढ़े। त्रैमाणी)

सच्चिदुना ईमामे हसन मुजतबा : ने फरमाया : ऐ भाई !  
आज मैं एक ऐसे मुआ-मले में दाखिल होने वाला हूं जिस में पहले कभी दाखिल नहीं हुवा था और आज मैं अल्लाह **غَوْلَجَلْ** की खल्क में से ऐसी मञ्जूक को देख रहा हूं जिस की भिस्त मैं ने कभी नहीं देखी।

(تاریخ الخلفاء ص ۱۰۳ ملخصاً)

**صَلُوٰاتٌ عَلَى الْحَبِيبِ ! صَلُوٰاتٌ عَلَى عَلِيٍّ مُحَمَّدِ**

### शहादत का सबब

हजरते सच्चिदुना ईमामे हसन मुजतबा को झट्टर दिया गया। उस झट्टर का आप **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** पर ऐसा असर हुवा के आंते टुकडे टुकडे हो कर खारिज होने लगीं, 40 रोज़ तक आप **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** को सप्त तकलीफ़ रही।

### वक़ात हसरत आयात

ईमामे आली मकाम, ईमामे अर्श मकाम, ईमामे हुमाम हजरते सच्चिदुना ईमाम अबू मुहम्मद हसन **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ने 5 बीउल अव्वल 50 छि. को मठीनतुल मुनव्वरह में ईस दारे ना पाएदार से रिहलत फरमाई (यानी वक़ात पाई), **إِنَّ اللَّهَ وَإِنَّا إِلَيْهِ لَمْ جُعْنَ**. (صفة الصفة ج 1 ص ۳۸۶) ये ही कहा गया है कि 49 छि. में वक़ात हुई। वक़ते शहादत हजरते सच्चिदुना ईमामे हसन मुजतबा **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** की उम्र शरीफ़ 47 साल थी। (تقريب الہنیب لابن حجر عسقلانی ص ۲۴۰)

ફરમાને મુસ્તફા : ﷺ : ﴿عَزَّ ذِلْكُ عَبْدٌ مَّنْ أَنْهَا نَارُ جَهَنَّمَ وَأَنْتَ مَنْ أَنْهَا نَارُ جَهَنَّمَ﴾ (طبراني).

## ﴿29﴾ નમાજે જનાગા

આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કી નમાજે જનાગા હજરતે સાચ્છદ બિન અલ આસ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** ને પઢાઈ જો ઉસ વક્ત મદ્દીનતુલ મુનવ્વરહ રાધી શર્ફાવું તેથી જે ગવર્નર થે. હજરતે સાચ્છદ ઈમામે હુસૈન ને **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કો જનાગા પઢાને કે લિયે આગે બઢાયા. (الاستيعاب ج ١ ص ٤٤٢ ملخصاً)

**صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

## ﴿30﴾ જનાગે મેં લોગોં કા રશ

હજરતે સાચ્છદ ઈમામે હસન મુજતબા કે જનાગે મેં ઈસ કદર જમ્મે ગફીર (Crowd) થા કે હજરતે સાચ્છદ સા'લબા બિન અબી માલિક રાધી શર્ફાવું ફરમાતે હું : મૈં ઈમામે હસન મુજતબા રાધી જનાગે મેં શરીક હુવા, આપ રાધી કો જનતુલ બકીઅ મેં (અપની વાલિદએ માજિદા કે પહ્લુ મેં) દફનાયા ગયા, મૈં ને જનતુલ બકીઅ મેં લોગોં કા ઈસ કદર ઈલ્હિદહામ (Crowd) દેખા કે અગર સૂઈ ભી ફેંકી જાતી તો (ભીડભાડ કી વજહ સે) વોહ ભી જમીન પર ન ગિરતી બલ્કે કિસી ન કિસી ઈન્સાન કે સર પર ગિરતી. (الاصابة ج ٢ ص ١٥)

**صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

## ઈમામે હસન કી ઓલાદ

આપ **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** કી કસીર ઓલાદ થી, ઈમામ ઈબને જોગી ને આપ કે શહઝાદોં કી તા'દાદ 15 ઔર સાહિબ જાહિયોં

કરમાને મુસતક્ફા : ﷺ : જિસ કે પાસ મેરા જિક હુવા ઔર ઉસ ને મુજ પર હુર્દે પાક ન પઢા  
તહીક વાં બદ બાજું હો ગયા. (ابن سની)

કી તા'દાદ 8 લિખી હૈ. (المنتظم ج ٢٢٥ ص ٥٠) જીબ કે ઈમામ મુહમ્મદ બિન  
અહમદ ઝહબી ને આપ રહ્મતُ اللَّهِ تَعَالَى عَنْهُ કે 12 શહજાદોं કે  
નામ લિખે હોય : હસન, જૈદ, તલ્હા, કાસિમ, અબૂ બક ઔર અબુલ્લાહ  
ઇન છ<sup>6</sup> ને અપને ચચાજાન સાચિદુશુ-હદા હજરતે સાચિદુના ઈમામે  
હુસૈન રહ્મતُ اللَّهِ تَعَالَى عَنْهُ કે સાથ મૈદાને કરબલા મેં જામે શહાદત નોશ કિયા.  
બકિયા છ<sup>6</sup> યેહ હોય : અબુ, અબુર્હમાન, હુસૈન, મુહમ્મદ, યા'કૂબ ઔર  
ઈસ્માઈલ. હજરતે સાચિદુના ઈમામે હસન મુજતબા  
સાચિદુના હસન મુસના ઔર હજરતે સાચિદુના જૈદ રહ્મતُ اللَّهِ تَعَالَى عَنْهُશા સે  
ચલા.

(سیر اعلام النبلاء ج ٤ ص ٤٠١)

صَلُّوا عَلَى الْحَبِيبِ!

ગમે મદીના, બડીઅ,  
મણિફરત ઔર બે  
હિસાબ જન્નતુલ  
ફિરદૌસ મેં આકા  
કે પડોસ કા તાલિબ  
૨-મજાનુલ મુખારક 1438 સિ.હિ.  
જૂન 2016 ઈ.



### ચેહ રિસાબા પટ કર દૂસરે કો દે દીજિયે

શાહી ગમી કી તકરીબાત, ઈજિતિમાઆત, આ'રાસ ઔર જુલૂસે મીલાદ વગેરા  
મેં મક-ત-બતુલ મદીના કે શાખેએ કર્દી રસાઈલ ઔર મ-દની કૂલ્લોં પર મુશ્તમિલ પેમ્ફ્લેટ  
તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિયતે સવાબ તોહકે મેં દેને કે લિયે અપની  
દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખાર ફરોશોં યા બચ્ચોં કે જરીએ  
અપને મહલ્યે કે ઘરોં મેં હંસે તૌકીક રિસાબે યા મ-દની કૂલ્લોં કા પેમ્ફ્લેટ હર માહ પહોંચ્યા  
કર નેકી કી દા'વત કી ધૂમે મચાઈયે ઔર ખૂબ સવાબ કમાઈયે.

ਫੇਹਰਿਸ

ઉન્વાન	સફળા	ઉન્વાન	સફળા
(1) ખુશક દરખત પર તાજા ખજૂરોં	1	તુમ સે તુમ્હારી ઓલાડ કે બારે મેં પૂછા જાએગા	16
(2) વિલાદત સે કલ્ય બિશારત	2	(15) હાથોં હાથ ઝડપત પૂરી કર દી	17
વિલાદતે બા સાચાદત વ નામ વ અલ્કોઅ	3	(16) દસ હજાર દિરહમ સે નવાજ દિયા	17
હમ-શક્તિ મુસ્તાકા	4	(17) હાજ પર ઓહસાન કરને વાલે	
એસા બેટા ડિસી માં ને નહીં જના !	4	બખ્શ ટિયે જીતે હું	18
શક્કાટે મુસ્તાકા મરહબા ! મરહબા !	4	(18) મેહમાન નવાજ બુઢિયા	19
(3) રાડિયે દોશે મુસ્તાકા	5	(19) સબ કુછ ઘૈરાત કર દિયા	21
(4) અધૂ હુરૈરા ટેખતે તો રો પડતે	5	(20) શૌકે તિલાવત	21
(5) એ મેરે સરદાર !	6	(21) મા'મૂલાતે ઠમામે હસન	22
(6) યેહ મેરા કૂલ હૈ	7	(22) મદ્દાના તા મકા 20 બાર પૈદલ સફર	23
(7) મેરા યેહ બેટા સરદાર હૈ	8	(23) ગુલામ આજાદ કર દિયા	23
(8) ઠમામે હસન મુજજ્તબા કા બિલાફિત	9	(24) અગર એક કાન મેં ગાલી ઔર દૂસરે.....	24
(9) ઠમામે હસન મુજજ્તબા કા ખુટ્ભા	9	(25) નમાજ કે વકત રંગ બદલ જાતા	24
(10) હુન્યા કી શર્મ અજાબે આભિરત સે બેહતર હૈ	10	(26) કુટે પર શક્કાટ કરને વાલા બા કંપાલ ગુલામ	24
સબ સે પહેલે ગોસે આ'જમ	10	(27) ઠમામે હસન મુજજ્તબા કા ઘ્યાબ	25
બિલાફિતે રાશિદા	11	(28) એસી મખ્લૂક પહેલે કલ્બી નહીં દેખી	26
(11) એ અલ્હાહ અલ્હ ! મેં ઈસ સે		શહાદત કા સભબ	27
મહાબ્બત કરતા હું	12	વર્ણત હસરત આયાત	27
(12) મુન્ને કી પૈદાઈશ	12	(29) નમાજે જનાજા	28
(13) સુરમા વ મુખુબુ સે મેહમાની	14	(30) જનાજે મેં લોગોં કા રશ	28
(14) બચપન મેં હદ્દાસ સુન કર યાદ કર લી	15	ઠમામે હસન કી ઓલાદ	28
બચ્ચોં કો અચ્છા અદબ સિખાઓ	16	યા હસન ઈન્ને અલી ! કર દો કરમ	31

مأخذ و مراجع

كتاب	مطبوعه	كتاب	مطبوعه	كتاب	مطبوعه
قرآن کریم	تاریخ اسلامیہ امیرورا	دارالکتب الحججیہ بیروت	الاصحیۃ	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
روح الہبیان	دارالطباطبائیہ امیرورا	تاریخ بغداد	تقریب الحدیث	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
بخاری	دارالطباطبائیہ امیرورا	الاسنیحیات	تاریخ بغداد	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
ترمذی	بیہقی امام	بیہقی امام	تاریخ بغداد	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
ابن ماجہ	استخفف	شواهد الحجۃ	القول البدیع	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
الادب المفرد	مسند بن عاصم	مسند البخاری انتبول	مسند البخاری	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
مسند بن عاصم	مسند البخاری امیرورا	مسند البخاری انتبول	شواهد الحجۃ	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
المصری	ویضی العسکری	ایام الحرام	ایام الحرام	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
شعب الامان	تاریخ بغداد	بخاری شریعت	بخاری شریعت	سلیمان	تاریخ بغداد
علی ولادیاء	تاریخ بغداد	بخاری شریعت	بخاری شریعت	دارالکتب الحججیہ بیروت	دارالکتب الحججیہ بیروت
الطیفات الکتبیہ	مسکنۃ الشیعۃ قیاقۃ	سوانح کربلا	سوانح کربلا	سیم اعلام احلام	دارالکتب الحججیہ بیروت

કરમાને મુસના : ﷺ : જિસ કે પાસ મેરા જિક હુવા ઔર ઉસ ને મુજ પર દુર્ગદ શરીક ન પણ  
(ઉસ ને જરૂર કી. عبد الرزاق)

## યા હસન ઈબને આલી ! કર દો કરમ !

રાકિબે દોશે શહન્શાહે ઉમમ  
ફાતિમા કે લાલ હૈદર કે પિસર !  
અપને નાના કી મહાબત દીજિયે  
ખૂ મિટે બેકાર બાતોં કી, રહે  
એ સખી ઈબને સખી અપની સખા  
આલો અસહાને નબી સે ઘાર હૈ  
પેશવાએ નૌ જવાનાને બિહિશત  
યા હસન ! ઈમાં પે તુમ રહના ગવાહ  
આહ ! પલ્લે મેં કોઈ નેકી નહીં  
મેરા દિલ કરતા હૈ મૈં ભી હજ કરું  
તયબા દેખે ઈક ઝમાના હો ગયા  
જગબા દો “નેકી કી દા’વત” કા મુજે  
મૈં સદા દીની કુતુબ લિખતા રહું  
દીન કી બિદમત કા જોશો વલ્લબા

યા હસન ઈબને આલી ! કર દો કરમ !  
અપની ઉલ્લત દો મુજે દો અપના ગમ  
ઔર અતા હો કલ્લે મુજૂતર ચશ્મે નમ  
લબ પે જિકુલ્લાહ મેરે દમ બદમ  
સે દો હિસ્સા સચ્ચિદ આલી હશમ  
સારી સરકારોં કે દર પર સર હૈ ખમ  
હૈ મુહમ્મદ કે નવાસે લા જરમ  
અબે હક હું ખાહિમે શાહે ઉમમ  
અર્સએ મહશર મેં રખ લેના ભરમ  
હો અતા જાદે સફર ચશ્મે કરમ !  
યા હસન ! દિખલા દો નાના કા હરમ  
રાહે હક મેં મેરે જમ જાઓં કદમ  
યા હસન ! દે દીજિયે ઐસા કલમ  
હો ઈનાયત યા ઈમામે મોહતરમ !

એ શહીદી કરબલા કે ભાઈજાન !

દૂર હોં અતાર કે રન્ધો અલમ

અદ્દાજ વ માયાની :- રાકિબ : સુવાર. દોશ : કન્ધા. લાલ : બેટા. પિસર : બેટા. મુજૂતર :  
બે કરાર. ચશ્મે નમ : રોતી આંખ. ખૂ : આદત. લબ : જબાન. દમ બદમ : હર વક્ત. સખા :  
સખાવત. આલી હશમ : બહુત બુગુર્ગી વાલા. ખમ : જુકા હુવા. અર્સએ મહશર :  
કિયામત કા મૈદાન. ભરમ : લાજ. સદા : હમેશા. વલ્લબા : બહુત જિયાદા શૌક.  
અલમ : ગમ.

الحمد لله رب العالمين والصلوة والسلام على سيد المرسلين أبا الصادق العترة الطيبة من الشفطين الرضييin وسلام الله الرحمن الرحيم

## નેક નમાજી બનને કે લિયે

હર જુમા'રત બા'દ નમાજે ઈશા આપ કે યહાં હોને વાલે દા'વતે ઈસ્લામી કે હક્કતવાર સુન્નતો ભરેં ઈજિતમાં મેં રિઝાએ ઈલાહી કે લિયે અચ્છી અચ્છી નિયતો કે સાથ સારી રત શિર્કત ફરમાઈયે સુન્નતો કી તરબિયત કે લિયે મ-દની કાફિલે મેં આશિકાને રસૂલ કે સાથ હર માહ તીન દિન સફર ઔર રોજાના “ફિક મદીના” કે જરીએ મ-દની ઈન્નામાત કા રિસાલા પુર કરકે હર મ-દની માહ કી પહલી તારીખ મેં અપને યહાં કે જિમ્મેદાર કો જમ્મ કરવાને કા મા'મૂલ બના લીજિયે.

**મેરા મ-દની મકસદ :** “મુજે અપની ઔર સારી હુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હૈ. એનું ક્ષાણ લેવા અપની ઈસ્લાહ કે લિયે “મ-દની ઈન્નામાત” પર અમલ ઔર સારી હુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે “મ-દની કાફિલો” મેં સફર કરના હૈ. એનું ક્ષાણ લેવા



મક-ત-ખતુલ મદીના®  
દા'વતે ઈસ્લામી



ફેઝાને મદીના શ્રી કોનિયા બગીયે કે પાસ, મિરગપૂર, અહમદાબાદ, ગુજરાત, ઇન્ડિયા  
 Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net